'Private sector investments show signs of revival'

STEADY PROGRESS. Capital formation cycle 'unfolding at a steady pace', says CEA Anantha Nageswaran

Shishir Sinha New Delhi

Investments by the private sector are showing signs of picking up, said Chief Economic Adviser V Anantha Nageswaran, on Thursday.

"We do see signs of the corporate sector beginning to make investments. There are some new investment announcements," he said at the CII's annual session. Based on the data available for the first six months of the last three years, he said it was ₹2.1-lakh crore in 2020-21; ₹2.7-lakh crore in 2021-22; and ₹3.3-lakh crore in 2022-23.

Expressing optimism about the private sector's capital formation cycle in the country, he said: "We have been waiting for it. It's



KEY ROLE. CEA V Anantha Nageswaran said fossil fuels have an important role to play in the economy KAMALK NARANG

already unfolding. It is unfolding at a steady pace."

KEY CONCERN

Capacity utilisation in some sectors such as steel and cement has reached a point

where greenfield investment has to happen," he added.

Observing that energy is an important driver of economic growth, he said it is energy security that is coming under a lot of pressure thanks to geopolitical developments and climate change.

"If there is a single-most important worry in my mind for sustaining the growth rate that we have been able to achieve in the last 2-3 years, it is energy security. We cannot completely swear off fossil fuels," he said.

The government has a target to balance the proportion of non-fossil fuels and fossil fuels in our energy mix, in terms of installed capacity, by 2030. It is equally important we understand that there are important roles for fossil fuels - if not coal, then gas," he

And, therefore, if the financial industry completely avoids funding fossil fuelbased power generation projects, then economic growth will suffer.

"And if we place economic growth in jeopardy, then the generation of fiscal and private sector resources will also be in jeopardy and, therefore, our ability to provide the right kind of financing for dealing with climate change will also be in doubt," he said.

Asked about the interest rate outlook, Nageswaran said: "I have always said in my last 16 months in this job that I don't comment on [Indian] monetary policy in public. So, I am not going to change that stance." With regard to the US Fed, he said they have given the indication that they will be on pause in June.

"I also don't believe that in the US case, rate cuts are imminent. I don't think so. Unless, of course, there are further financial accidents like we saw in March and April, because if you look at the macro data, they are still holding up pretty well.

"So, I think stable for longer might be more likely than looser policy, but that's my personal view," he said.

R Dinesh elected President of CII

Our Bureau New Delhi

The Confederation of Indian Industry (CII) has elected R Dinesh, the Executive Vice-Chairman of TVS Supply Chain Solutions, as its President for 2023-24.

He takes over from Sanjiv Bajaj, the Chairman and Managing Director of Bajaj Finserv Limited.

Dinesh is a fourth-generation member of the TVS family. He founded TVS Supply Chain Solutions (formerly TVS Logistics) in 1995, and steered the company into a



R Dinesh, CII's new President

billion-dollar organisation. Sanjiv Puri, the Chairman and MD of ITC Ltd, will assume the role of President-Designate for the year 2023-

Rajiv Memani, Chairman of the India region of Ernst & Young, has been appointed as Vice-President.

'India poised for world-beating growth'

India's strong credit demand and softening crude oil prices could buoy the economy, putting it on course for a 6.5 per cent expansion this fiscal year, according to a top adviser to the Finance Ministry.

These indicators, gether with an uptick in construction activity, may shield the economy from slower global growth and weather-related risks, said Chief Economic Adviser, V Anantha Nageswaran.

Data next week is likely

to show the economy expanded 7 per cent in the year that ended March, according to Bloomberg estimates compiled on Thursday.

While higher borrowing costs might have slowed some activity, India remains the world's fastestgrowing major economy, outpacing China and drawing foreign inflows into the equity markets.

"In the economic survey we said 6.5 per cent is our baseline with the downside risks more than the upside risks and we maintained it in the April monthly ecoNageswaran, "Now I am incrementally, slightly more inclined to move to the neutral range, in saying risks to this number are evenly balanced in the kind of position I am willing to

'ON RIGHT TRACK'

take," he added.

So barring the monsoon and geo-political risks, India's economy is on a "steady auto-pilot" and "ticks all the right boxes at point," Nageswaran.

High-frequency indicators showed India's economy gaining momentum in April thanks to higher tax collections and a booming services sector.

However, exports and imports declined, smudging the outlook.

For Nageswaran, the data is positive overall. Trade is "not singing a different tune" as goods exports are falling on slowing global demand, and the decline in imports is due to lower crude oil prices, he said.

Nageswaran said he is "confident about the inflation trajectory", and sees it slowing further to 4 per cent by next year if crude

Innovate, not imitate, to become tech leader: Rajnath Singh tells industry

Our Bureau

Innovate to make India a 'leader' from an 'imitator' of futuristic technologies in defence and other sectors, Defence Minister Rajnath Singh told the industry on Thursday at the annual session of the Confederation of Indian Industry (CII).

Throughout his address, themed 'Future Frontiers: Competitiveness, Technology, Sustainability and Internationalisation', the Defence Minister focussed on the importance of research and development (R&D) for generational leap solutions in sectors such as defence, health, education, agriculture, commerce, and communication through emerging technologies.

'INVEST IN R&D'

Our Bureau

He urged the industry to invest in R&D and increase the capacity of in-house research. The Minister invited

the industry to give sugges tions for changes they feel should be brought into defence-related policies, and promised to look into them for the ease of doing business.

Singh pointed out that there are two faces to the technology paradigm across the globe - one of a leader nation, which grabs an opportunity, innovates, and invents a new technology - the other of an imitator, which follows the leader. Stating that new technological avenues are coming to the fore without any established leader, he exhorted industry captains to strive to make India a technology leader from an imitator.

"We need to set new goals and achieve them through innovative methods to keep ourselves prepared to deal with any challenges arising out of the ever-evolving global situation," said the Minister. "R&D has the ability to convert things, which are viewed as resources, into

Delayed power projects: Government will

crackdown on developers, says RK Singh



Defence Minister Rajnath Singh addresses the CII AGM in New Delhi KAMALNARANG

resources. Technology improves the utilisation of available resources. It acts as a force multiplier," he added.

In today's era, security equations, according to the Minister, are changing at an unprecedented pace, and countries are focussing more than ever on technological advancements in the fields of artificial intelligence, quantum computing, and ge-

"To keep ourselves strong, we need to maintain our edge in these sectors. It will be possible only if we become technology leaders," he said.

HUMAN RESOURCES

With new technologies replacing the old regime, Singh exhorted the CII to invest in human resources for capacity building. He shared insights into another dimension of technology, or 'socio-economic technology' which, according to him, is commonly referred to as governance.

The country's population, once considered a liability, is now being viewed as an asset, he insisted. "India is passing through a demographic dividend. Policies have been rolled out for the optimum utilisation of this population,"he said.

The Minister exuded confidence that the government's efforts will convert the demography into a 'wealth-creating resource' from mere 'wealth-consumingentity'.

Place: Chennai

Date: May 25, 2023

SMART ALOT SMARTER.

COMING SOON



HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020. Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Extract of statement of standalone and consolidated financial results for the quarter and year ended March 31, 2023 (₹ in lacs except per share data)

			S	tandalone				C	onsolidated		
S. No.			Quarter ended	ı	Year	ended		Quarter ende	i	Year	· ended
	Particulars	March 31, 2023	December 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022	March 31, 2023	December 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations	15,070.02	10,637.03	4,432.18	40,895.67	14,730.88	17,932.03	17,156.25	4,362.66	56,771.08	16,718.91
2	Net Profit for the period (before tax and exceptional items)	10,697.14	1,591.98	2,347.15	16,366.73	7,019.04	11,011.82	4,815.05	764.93	20,951.17	5,405.00
3	Net Profit/(loss) for the period before tax (after exceptional items)	10,697.14	1,591.98	(1,089.38)	16,366.73	3,582.51	11,011.82	3,593.06	(2,671.60)	19,729.18	1,968.47
4	Net Profit/(loss) for the period after tax (after Exceptional items)	10,697.14	1,591.98	(1,089.38)	16,366.73	3,582.51	10,665.39	3,733.58	(2,721.14)	19,404.82	1,999.37
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10,703.35	1,590.97	(1,096.61)	16,369.90	3,578.45	10,671.60	3,732.57	(2,728.37)	19,407.99	1,995.31
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93
7	Reserves				79,740.47	63,370.57				81,494.32	62,086.33
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized) Basic EPS ₹ Diluted EPS ₹	₹ 8.09 ₹ 8.09	₹ 1.20 ₹ 1.20	₹ (0.82) ₹ (0.82)	₹ 12.37 ₹ 12.37	₹ 2.71 ₹ 2.71	₹ 8.06 ₹ 8.06	₹ 2.82 ₹ 2.82	₹(2.06) ₹(2.06)	₹14.67 ₹14.67	₹ 1.51 ₹ 1.51

The above is an extract of detailed format of Quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results is available on the stock exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com.

> BY ORDER OF THE BOARD For Hindustan Oil Exploration Company Limited P. Elango R. Jeevanandam Managing Director DIN: 07046442 DIN: 06475821



According to him, electricity generation capacity addition is a big challenge, and many developers are reportedly delaying projects they won under the bidding process. Nearly 50,000 MW of un-

der construction projects for capacity addition - have been held back by bidders.

TO BE BANNED

According to the initial plans, if developers miss the scheduled commercial date of operation or deadline to complete the project (SCOD) — which was won under a bidding process — then they will be banned from participating in



Power and New and Renewable Energy

project bidding for one year. For a repeat of the same offence, a second-time failure, the developer will be banned for five years, said Singh.

"We [plan] to put this [rule] in [policy]. Failing in SCOD will not be healthy, until and unless you have good reasons. So, if you bid, bid with foresight and [due] deliberations," he said while speaking at the annual session of the CII. Power project developers are waiting for demand to grow, but this will not happen, he said. Discom losses are down from 22 per

cent to 17 per cent last fiscal, and will come down to "less than 15 per cent, next year", said Singh, adding that legacy dues of the sector are down 50 per cent, and will be "wiped out in the next 8-9 months or

sions are among the lowest in the world, and 40 per cent of India's power capacities sources. The target is to get 45 non-fossil fuel sources by

of thermal capacity under construction," he said, adding that until battery energy storage becomes viable, India will have to add thermal power capacity to meet demand. At present, battery storage is ₹10 per unit (per kilo watt hr)

sources by 2030.

India's per capita emis-

comes from non-fossil fuel per cent of capacities from "We have over 52,000 MW

and the energy rate is ₹2.30. "We have to come up with more viability gap funding," he said. And if storage becomes viable by then, nearly 65 per cent of capacities will come from non-fossil fuel LIC HFL **PUBLIC NOTICE**

LIC HOUSING FINANCE LIMITED

LIC HOUSING FINANCE LTD., hereby brings to the notice of general public and LICHFL customers that our Ahmedabad – II area office situated at address as under: IC Housing Finance Limited, Shop No. 110,111, Radhe Kishan Villa, First Floor, Jayamala Four Cross Road, Govindwadi, Isanpur, Ahmedabad - 382443

The above office will cease its operations w.e.f 01/09/2023. All the customers who have availed loan from Ahmedabad – Il office can now contact our Ahmedabad branch located at below address for future servicing of loans LIC Housing Finance Limited, 203B-204-205, Central Business Space,

Near Usmanpura Cross Road, Ashram Road, Ahmedabad - 380013 Contact No. 9930618262 Sd/- Manager (Operations

LIC Housing Finance Ltd., Ahmedabad Back Office

equitas

EQUITAS SMALL FINANCE BANK LTD. (Previously known as Equitas Finance Ltd)

crpcrate Office: 4th Floor, Phase-II, Spencer Plaza, No. 769, Mount Road, Anna Salai, Chennai, TN- 600 00

POSSESSION NOTICE

(Rule 8(1) Of The Security Interest Enforcement Rules, 2002) (For Immovable Property Loan / Facility Account No's. 700000871649 / EMFSURTA0030840 &

700000580405 / ELPSURTA0030841. Whereas, The Authorized Officer of The Equitas Small Finance Bank Limited Ltd A Banking Company Incorporated Under The Companies Act, 1956 and Carrying on The Banking Business Under The Banking Regulation Act, 1949 Having its Registered Office At 4th Floor, Phase II, Spencer Plaza, 769, Anna Salai, Chennai, Tamilnadu 600002, State Office At Equitas Small Finance Bank Limited 305-306, 3rd Floor Abhishree Adroit, Near Sunrise Mall, Mansi Circle, Judges Bunglow Road, Bodakdev Ahmedabad, Gujarat-380015 and One of the office at Equitas Small Finance Bank Limited, Kaushailya Tower, B8, Main Road, 1st Floor, West Patel Nagar, New Delhi 110008, Under The Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of The Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 28.02.2023 Calling Upon Applicant/Borrower/Co Applicant/Co-Borrower/Guarantors/Mortgagors (1) Mr. Manish Kishorbhai Vaja S/o Kishorbhai Vaja (Applicant/ Borrower & Mortgagor) (2) Mrs. Heenaber Manishbhai Vaja W/o Manish Vaja (Co-Applicant/ Co- Borrower & Mortgagor) (3) Mrs. Vaja Nitin Kishor S/o Kishorbhai Vaja (Co- Applicant/ Co- Borrower & Mortgagor) to repay the amount mentioned in the notice being Rs. 46,92,323/-(Rupees Forty Six Lac Ninety Two Thousand Three Hundred Twenty Three only due as on 17.02.2023. With subsequent interest, penal interest, charges, costs etc as per the agreement(s) within 60 days from the date of receipt of the said notice.

The Applicant/ Borrower/ Co-Applicant/ Co-Borrower/ Guarantors/ Mortgagors, Having Failed to repay the amount, notice is hereby given to the Applicant/ Borrower/ Co-Applicant/ Co-Borrower/ Guarantors/ Mortgagors in Particular and The Public II General That The Undersigned Authorized Officer Has Taken Symbolic Possession of The Property Described Herein Below in Exercise of Powers Conferred On Him/ He Under Section 13(4) of The Said Act Read With Rule 8 of The Said Rules on this 24th day of May of the year 2023.

The Applicant/ Borrower/ Co-Applicant/Co-Borrower/Guarantors/ Mortgagors Attention Is Invited To Provisions of Sub-Section (8) of Section 13 of The Said Act. In Respect of Time Available, To Redeem The Secured Assets.

The Applicant / Borrower/ Co-Applicant/Co-Borrower/Guarantors/ Mortgagors Particular And The Public In General Is Hereby Cautioned Not To Deal With The Property And Any Dealings With The Property Will Be Subject To The Charge Of Equitas Small Finance Bank Limited For The Amount of Rs. 46,92,323/-{Rupees Forty Six Lac Ninety Two Thousand Three Hundred Twenty Three only) due as on 17.02.2023 And Interest Thereon From 22.01.2023

Schedule of the Security (S) Residential Property Owned By Mrs. Heenaben Manishbhai Vaja W/o Manish Vaja & Mr. Manish Kishorbhai Vaja S/o Kishorbhai Vaja

All that pieces and parcel of property bearing Plot No. C-136 admeasuring 12 feet x 40 fee i.e. 480 Sq.Feet i.e. 53.33 Sq.yards i.e. 44.61 Sq.Mtrs, along with 44.61Sq.Mtrs Ground Floor & 44.61 Sq.Mtrs First Floor Construction, totally admeasuring 89.22 Sq. Mtrs Construction in "Godavari Park". Situate at revenue survey no. 328, block no. 372 8 revenue survey no. 330, 331, block no. 373, as per 7/12 admeasuring 11635 as. Mtrs and 9106 Sq.Mtrs, T.P. Scheme No.60 (Puna), final plot ng. 143-A admeasuring 5488 Sq.Mtrs final plot no.143-B admeasuring 2645 Sq.Mtrs, final plot no. 143-C admeasuring 2511 Sq.Mtrs and final plot no. 144 admeasuring 8390 Sq.Mtrs, totally admeasuring 19040 Sq.Mtrs of Moje Village: Puna, Sub-District: Surat City, District-Surat

Four corners of said property:- North: Adj. Plot No. D-136, South: Adj. Block No. 37 East: Society Internal Road, West: Adj. Block No. 371

Date: 24/05/2023 Authorised Officer For Equitas Small Finance Bank Ltd Place: Surat

equitas

EQUITAS SMALL FINANCE BANK LTD (FORMERLY KNOWN AS EQUITAS FINACNE LTD Registered Office: No.769, Spencer Plaza, 4th Floor, Phase-II. Anna Salai. Chennai - 600002

Phone No. 044-42995000, 044-42995050 SALE NOTICE FOR THE SALE OF IMMOVABLE PROPERTY

E-Auction Sale Notice for the sale of immovable assets under SARFAESI Act, 2002, R/w rule 8(6) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrowers, Co borrowers and Guarantors that the below escribed immovable property mortgaged to the Secured creditor, the Physical possession of which has been taken by the Authorised Officer of Equitas Small Finance Bank Ltd., will be sold on 27-06-2023 "AS IS WHERE IS" "AS IS WHAT IS CONDITION" for recovery of below mentioned amount due to Equitas Small Finance Bank Ltd., from the following

Borrower/s & Guarantor/s Name & Address Total Due + Interest from	Description of the Immovable Property
1. Mr. Bhosle Dinesh S/o. Mr. Ramachandra 2. Mrs. Bhosle Hansaben W/o. Mr. Ramachandra Both are residing at A/502, Raina Madhav Apt, Near Jalaram temple, Vesu, Surat,	All the piece of immovable property bearing as per Sanction plan plot No. 155, & as per place private Plot No. 203 admeasuring 39.02 sq.mts. Along with 21.23 sq.mts undivided share in the land of Road & C.O.P. totally admeasuring 60.25 sq. mts. In "Nandavan Residency" Situated on the non agriculture land bearing Revenue Survey No. 42/3, Block No. 71 of Moje Village: Kareli, Sub-District & Taluka: Palsana, District: Surat. North by: Plot No. 204 (As per Plan Plot NO. 156) South by: Plot No. 202 (As per Plan Plot NO. 154)

Plot No. 154) East by: Road West by: Vada. Measurement: admeasuring 39.02 sq.mts i.e. 420 sq. ft Situated at within the Sub-Registration District of PALSANA

(Authorized Officer), For, Equitas Small Finance Bank Ltd

and presently known as IDFC First Bank Limited

and Registration District of SURAT Together with all buildings and structure attached to the earth or permanently fastened to anything attached to earth, both present and future and all easamentary / mamool rights annexed thereto

Reserve Price: Rs.10,39,000/-Earnest Money Deposit: Rs.1,03,900/-Contact Names: Rajan Sureshbhai Chudasama: 8160325866, Sachin Solanki Kumar: 9099800946

Date of Auction: 27-06-2023 For detailed terms and conditions of the E-Auction sale, please refer to the link provided in www.equitasbank.com & https://sarfaesi.auctiontiger.net

IDFC FIRST Bank Limited

Loan Account No.- EMFVRCHA0020910

Claim Amount Due Rs.1015066/- as on

17-09-2021 with further interest from

costs, etc., (Total Outstanding being

Rs.1108589/- as on 20.05.2023).

Date: 26.05.2023 Place: Chennai

18-09-2021 with monthly rest, charges and

erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792 Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 60003

IDFC FIRST Bank Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

lowing borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the nentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as no the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as pe contractual rate with effect from their respective dates.

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	amount as per Section 13 (2) Notice	Property Address
1	40649140	Home Loan	1. Vasava Fatesingbhai 2. Vasava Januben	30.11.2022	INR 12,75,894.69/-	All That Piece And Parcel Of An Immovable Property Bearing Plot No.13 Admeasuring 66.91 Sq. Mtrs., Along With 46.54 Sq. Mtrs. Undivided Share In The Land Of Road & Cop, Total Admeasurung 113.45 Sq.mts., In "Shree Laxmi Balaji Residency" Situate At Revenue Survey No.54, Block No.45, Of Moje Village Kuvarda, Ta: Mangrol, Dist: Surat, And Bounded As: East: Plot No.12, West: Space, North: Society Road, South: Other Property

rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) . Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise

> Authorized Office IDFC First Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited

NILA INFRASTRUCTURES LIMITED

(CIN: L45201GJ1990PLC013417)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015 Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922

E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

			0					0		(₹ in Lakh
		0	Standalone	V 1	-1-1		O	Consolidated	V1	r - 4 - 4
		Quarter Ended		Year E			Quarter Ended		Year	Ended
SN Particulars	31-03-23	31-12-22	31-03-22	31-03-23	31-03-22	31-03-23	31-12-22	31-03-22	31-03-23	31-03-22
(Refer Notes below)	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1 Total Income from Operations	4,631.41	3,186.70	2,756.53	12,819.79	10,613.31	4,618.31	3,148.80	2,435.59	12,709.64	9,422.82
2 Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items)	50.92	97.26	171.43	288.07	364.85	38.30	63.14	139.54	190.04	176.56
Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)	50.92	97.26	171.43	288.07	364.85	38.30	63.14	139.54	190.04	176.56
4 Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	28.52	64.08	122.21	177.32	251.02	1.93	(6.65)	(108.34)	(44.96)	(198.16)
5 Total Comprehensive Income for the period [Comprising Profiti (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	31.25	64.08	122.58	180.05	258.44	4.66	(6.65)	(107.97)	(42.23)	(190.74)
6 "Equity Share Capital (Face Value of ₹ 1/- per share)"	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7 Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)				10,890.57	10,710.52				9,324.44	9,366.67
8 Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)										
Basic (in ₹)	0.01	0.02	0.03	0.05	0.06	0.001	(0.002)	(0.03)	(0.01)	(0.05)
Diluted (in ₹)	0.01	0.02	0.03	0.05	0.06	0.001	(0.002)	(0.03)	(0.01)	(0.05)

Date: 26.05.2023

Place : Surat

The above is an extract of the detailed format of quarter and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 25, 2023 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and year ended Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilainfra.com

Place · Ahmedahad Date: May 25, 2023

Place: Chennai

Date: May 25, 2023

By Order of the Board of Directors Manoj B Vadodaria Chairman and Managing Director DIN: 00092053

(₹ in lacs except per share data)



HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020.

Extract of statement of standalone and consolidated financial results for the quarter and year ended March 31, 2023

									(
S. No.	Particulars		S	tandalone			Consolidated					
		Quarter ended			Year	Year ended		Quarter ended			Year ended	
		March 31, 2023	December 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022	March 31, 2023	December 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022	
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	
1	Total Income from Operations	15,070.02	10,637.03	4,432.18	40,895.67	14,730.88	17,932.03	17,156.25	4,362.66	56,771.08	16,718.91	
2	Net Profit for the period (before tax and exceptional items)	10,697.14	1,591.98	2,347.15	16,366.73	7,019.04	11,011.82	4,815.05	764.93	20,951.17	5,405.00	
3	Net Profit/(loss) for the period before tax (after exceptional items)	10,697.14	1,591.98	(1,089.38)	16,366.73	3,582.51	11,011.82	3,593.06	(2,671.60)	19,729.18	1,968.47	
4	Net Profit/(loss) for the period after tax (after Exceptional items)	10,697.14	1,591.98	(1,089.38)	16,366.73	3,582.51	10,665.39	3,733.58	(2,721.14)	19,404.82	1,999.37	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10,703.35	1,590.97	(1,096.61)	16,369.90	3,578.45	10,671.60	3,732.57	(2,728.37)	19,407.99	1,995.31	
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	
7	Reserves				79,740.47	63,370.57				81,494.32	62,086.33	
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized) Basic EPS ₹ Diluted EPS ₹	₹ 8.09 ₹ 8.09	₹ 1.20 ₹ 1.20	₹ (0.82) ₹ (0.82)	₹ 12.37 ₹ 12.37	₹ 2.71 ₹ 2.71		₹ 2.82 ₹ 2.82	₹(2.06) ₹(2.06)	₹14.67 ₹14.67	₹ 1.51 ₹ 1.51	

The above is an extract of detailed format of Quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results is available on the stock exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com

> BY ORDER OF THE BOARD For Hindustan Oil Exploration Company Limited R. Jeevanandam

CIN - L65110TN1921PLC00190

Tamilnad Mercantile Bank Limited

Ringroad Branch:

Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas,

Ringroad Branch, Surat - 395002, Gujarat Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

Auction Notice for Sale of Immovable Properties

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower M/s. Jayveer Fashion Proprietor: Mr. Finaviya Jaydeep Vinubhai, S/o. Vinubhai Kanjibhai Finaviya Guarantor: Mr. Finaviya Vijay Vinubhai, S/o.Vinubhai Kaniibhai Finaviva The below described Movable/ immovable properties mortgaged/charged/ hypothecated to the Secured Creditor, the Physical possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited Ringroad Branch, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 14.06.2023 for recovery of Rs.1,39,89,767.86 (Rupees One Crore Thirty Nine Lakhs Eighty Nine Thousand Seven Hundred Sixty Seven and Paise Eighty Six Only) {Rs.1,14,81,491.14 in Over Draft and Rs.25,08,276.72 in Term Loan(GECL) as on 30.04.2023 plus subsequent interest and expenses due to the Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch. The reserve price and Earnest Money Deposit will be as under: The Reserve Price for property No.1 will be Rs. 80,00,000/- and the earnest money deposit will be

Description of the Property

On equitable mortgage of undivided proportionate share in Land to the extent of 6075.00 Sq.mt situated at 'SAHAJANAND HEIGHTS' and shop building constructed thereat to the extent of 78.47 Sq.mt of Shop No.10 together with undivided proportionate share in underneath land admeasuring 39.81 Sq.mt, First Floor of "A" and "B" Constructed on the Land bearing F.P.No.87/A of Block 286 (Revenue Survey No.260/2 & 261 Paikee), T.P.S.No.68 (Puna), Original Plot No.87, F.P.No.87/A & 87/B, at Yogi chouk Varachha-Surat, Village.Puna, Sub-District.Choryasi, District.Surat, Gujarat Standing in the name of Mr.Finaviya Jaydeep Vinubhai. Boundaries: South: Society Flat North: Parking East: Shop No-9 West: Parking

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditor's website ie., (www.tmb.in)

Place: Ringroad Date: 24.05.2023

Authorised Officer Tamilnad Mercantile Bank Ltd Ahmedabad Regional Office (For Ringroad Branch)

Be a step ahead in life CIN - L65110TN1921PLC00190

Tamilnad Mercantile Bank Limited

Ringroad Branch:

Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas Ringroad Branch, Surat - 395002, Gujarat

Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500. 2367600

Auction Notice for Sale of Immovable Properties

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provisor to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the M/s. Krishna Fashion, Proprietrix

Mrs. Chhashwala Unnatiben Kalpesh, w/o. Chhashwala Kalpesh Navinchandra and Guarantor / Mortgago

Mr.Chhashwala Kalpesh Navinchandra, S/o. Mr.Navinchandra Hasmukhlal Chhashwala and Guaranto

Mr.Khunt Mahesh Nanjibhai, S/o.Nanjibhai Shamjibhai Khunt that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorisec Officer of Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 14.06.2023, for recovery of Rs.1.16.23.755.68 (Rupees One Crore Sixteen Lakhs Twenty Three Thousand Seven Hundred Fifty Five and Paise Sixty Eight Only) as on 30.04.2023 due to Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch with subsequent interest and expenses. The Reserve Price for property No.1 will be Rs. 15,90,000/- and the earnest money deposit will be Rs. 1,59,000/-The Reserve Price for property No.2 will be Rs. 15,90,000/- and the earnest money deposit will be Rs. 1.59.000/-The Reserve Price for property No.3 will be Rs.18,70,000/- and the earnest money deposit will be Rs.1,87,000/-The Reserve Price for property No.4 will be Rs.13,10,000/- and the earnest money deposit will be Rs.1,31,000/-The Reserve Price for property No.5 will be Rs.13,10,000/- and the earnest money deposit will be Rs.1,31,000/-The Reserve Price for property No.6 will be Rs.15.50.000/- and the earnest money deposit will be Rs.1.55.000/-The Reserve Price for property No.7 will be Rs.9,00,000/- and the earnest money deposit will be Rs.90,000/-The Reserve Price fo**r property No.8** will be **Rs.9,30,000/-** and the earnest money deposit will be **Rs.93,000/-**The Reserve Price for property No.9 will be Rs.18,30,000/- and the earnest money deposit will be Rs.1,83,000/-The Reserve Price for property No.10 will be Rs.15,10,000/- and the earnest money deposit will be Rs.1,55,000/-

1.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B. T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up are 20.22 sq.mt(i.e 217.56 sq.ft), Carpet area 19.30 Sq.mt (I.e.207.66 Sq.Ft) bearing Shop No.A/106, 1st Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries North: Shop No. A/100 South: Passage East: Shop No. A/104 & A/105 West: Shop No. A/107

he Reserve Price for property No.11 will be Rs.10,50,000/- and the earnest money deposit will be Rs.1,05,000/-

The Reserve Price for **property No.12** will be **Rs.21,00,000/-** and the earnest money deposit will be **Rs.2,10,000/-**

2. On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B, T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 20.22 sq.mt(i.e 217.56 sq.ft), Carpet area 19.30 Sq.mt (I.e.207.66 Sq.Ft) bearing Shop No.A/107, 1st Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North:Shop No. A/108 South: Passage East: Shop No. A/106 West: Shop No. A/109 & A/110

3.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B, T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 23.90 sq.mt(i.e 257.16 sq.ft), Carpet area 22.65 Sq.mt (I.e.243.71 Sq.Ft) bearing Shop No.A/108, 1st Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries North: Shop No. A/10 South: Shop No. A/109 & A/107 Fast: Shop No. A/103 West: Passage

4.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B, T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up are 20.22 sq.mt(i.e 217.56 sq.ft), Carpet area 19.30 Sq.mt (I.e.207.66 Sq.Ft) bearing Shop No.A/206, 2nd Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist, Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Shop No. A/203 South: Passage East: Shop No. A/204 & A/205 West: Shop No. A/207

5.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B. T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 20.22 sq.mt(i.e 217.56 sq.ft), Carpet area 19.30 Sq.mt (I.e.207.66 Sq.Ft) bearing Shop No.A/207, 2nd Floor, Building No. A. Sicilia. Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan' Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Shop No. A/208 South: Passage East: Shop No. A/206 West: Shop No. A/209 & A/210

6.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.P No. 11/B, T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 23.90 sq.mt(i.e 257.16 sq.ft), Carpet area 22.65 Sq.mt (I.e.243.71 Sq.Ft) bearing Shop No.A/208, 2nd Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal. Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Shop No. A/20 South: Shop No. A/209 & A/207 East: Shop No. A/203 West: Passage

7.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B, T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up are 13.89 sq.mt(i.e 149.45 sq.ft), Carpet area 13.21 Sq.mt (I.e.142.14 Sq.Ft) bearing Shop No.A/209, 2nd Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Shop No. A/208 South: Shop No. A/210 East: Shop No. A/207 West: Passage

8.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B. T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 14.14 sq.mt(i.e 152.14 sq.ft), Carpet area 13.69 Sq.mt (i.e 147.30 Sq.Ft) bearing Shop No.A/210, 2nd Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Shop No. 209 South: Passage East: Shop No. 207 West: Passage

9.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317, F.F. No. 11/B. T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 28.70 sq.mt(i.e 308.81 sq.ft), Carpet area 26.86 Sq.mt (l.e.289 Sq.Ft) bearing Shop No.A/211, 2nd Floor, Building No A, Sicilia, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan), Dist. Surat standing in the name of Mr. Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Passage South: Open Space East: Stair West: Passage

10.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317 F.P. No. 11/B, T.P.S. No. 25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 28.70 sq.mt(i.e 308.81 sq.ft), Carpet area 25.98 Sq.mt (I.e.279.54 Sq.Ft) bearing Shop No.A/307, 3rd Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Passage South Open Space East: Stair West: Passage

11.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317 F.P. No. 11/B, T.P.S. No. 25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 19.30 sq.mt(i.e 207.66 sq.ft), Carpet area 17.73 Sq.mt (l.e.190.77 Sq.Ft) bearing Shop No.A/308, 3rd Floor, Building No. A. Sicilia. Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adaian) Dist, Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries North: Passage South Open Space East: Office No. 309 West: Stair

12.On Equitable Mortgage of undivided proportionate shares in land bearing R.S.No. 327+328+329, Block No. 317 F.P. No. 11/B, T.P.S. No.25 (Mota Varachha) and commercial building constructed thereat to the extent of Build Up area 37.92 sq.mt(i.e 408.02 sq.ft), Carpet area 35.69 Sq.mt (I.e.384.02 Sq.Ft) bearing Shop No.A/309, 3rd Floor, Building No. A, Sicilia, Opp. Panchdev Residency, Near Sudama Chowk, S.G. Road, Mota Varachha, Tal.Surat City (Adajan) Dist. Surat standing in the name of Mr.Kalpesh Navinchandra Chhashwala Boundaries: North: Passage South Open Space East: Office No. 310 West: Office No. 308

(The above collateral ae common for the credit Limits sanctioned to M/s.Unnati Creation (Cash Credit - Rs.99.00 lakhs.) Balance Outstanding as on 30.04.2023 for Rs. 1,15,64,129.63. The said account is in NPA Status

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditor's website ie., (www.tmb.in)

P. Elango Managing Director DIN: 06475821

Director & CFO DIN: 07046442

Tamilnad Mercantile Bank Ltd Place: Ringroad Ahmedabad Regional Office (For Ringroad Branch) Date: 24.05.2023



કળાને રાજીવન કરાઇ: કારીગર વજીરભાઇ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે ભરૂચજિલ્લાનું ધોરણ ૧૦નું ૬૧.૦૭%પરિણામ

सहाधी इछिन्डेशनना સહયોગથી વાંસ કળા જીવંત રાખવાનો પ્રચાસ

દહેજ,ભરૂચ,તા.૨૫

ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ ગ્રેડમાં ૧૮૦૫, E

જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 2 ગ્રેડમાં ૧૨૨૧

ઓછું ૫૫.૪૯% કંગાળ પરિણામ થયા છે.નર્મદા

આવ્યું છે, પરિણામની દ્રષ્ટિએ આખા જિલ્લામાં ૧૦%

રાજ્યમાં છેલ્લેથી બીજો એટલે કે ૩૩ પરિણામ ધરાવતી

નો ક્રમાંક આવ્યો છે.નર્મદા જિલ્લાનું ૩, ૨૦% પરીણામ

A 1 ગ્રેડમાં ૬, A 2 ગ્રેડમાં ૯૫, ૭૦.૮૮%, કેવડિયા કોલોનીનું

વર્ષ ૨૦૨૧ માં ૬૧.૦૧%, વર્ષ

૨૦૨૨ માં ૬૨.૪૧% અને વર્ષ

भारः नाभ

મહેન્દ્રકુમાર કેવલદાસ પટેલ

หอิสผาย นุวิต

કરેલ છે (પિતાના નામ વગર).

બી-૪૬, વૂડસ્કેપ,

બીલ, વડોદરા.

भारू नाभ

ગીતાબહેન મહેન્દ્રકુમાર પટેલ

માંથી

ગીતાબેન પટેલ

કરેલ છે (પતિના નામ વગર).

બી-૪૬, વૃદસ્કેપ,

બીલ, વડોંદરા.

<u>નામ બદલેલ છે</u>

भा३ नाभ इसङ रिहात

શિકારી હતું તે બદલીને

નવું નામ ફલક ઇકબાલ

જુજારા કરેલ છે.

સરનામુ: કે/ ७૫, તાઇફનગર સોસાચઢી- ૧, મધુરમની પાછળ, તાંદલજા રોક,વડોદરા ૩૯૦૦૧૨.

ગુજરાત, ઇન્કીયા.

Place: Chennai

Date: May 25, 2023

અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સમુદાયના ૫૦ સભ્યોને વ્યવસાયમાં સમુદાયની મહિલાઓનું એક સખી મંડળ એમને સરકારની વિવિધ યોજનાનો પણ કામ કરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર ૯૦૪, C 1 ગ્રેડમાં ૧૪૪૮, C 2 પ્રતાપનગરનુ ૪૯.૦૮%, સેલંબાનું

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગ્રેડમા ૮૮૬, D ગ્રેડમાં ૬૫, E 1 પ૯.૫૨%, માંગરોલનું ૫૮.૦૨%,

૨૦૨૩ માં ૫૫.૪૯% પરીષ્ટામ ધરાવતી ૧૨,૫૦% પરિષ્ટામ ધરાવતી ૬૮.૮૦%, તિંબાપાડાનું ૪૧.૩૦%

આવ્યું છે જ્યારે જિલ્લાનું ઉતાવરી 🛛 ૨૧, ૬૦% પરિણામ ધરાવતી ૨૨, 🐧 પરીણામ જાહેર થયું છે.રાજપીપળા

કેન્દ્ર ૧૧.૯૪% પરિણામ સાથે આખા ૭૦% પરીણામ ધરાવતી ૧૧, વાત્સલ્ય વિદ્યાલયના હેતિકા રોશન

રાજ્યમાં છેલ્લા નંબર પર છે, એ ૯૯% પરિણામ ધરાવતી ૮ અને પટેલ ૯૯.૯૧ પીઆર સાથે

જોતા જિલ્લાની શિક્ષણની ગુણવત્તા ૧૦૦% પરિણામ ધરાવતી પ જિલ્લામાં પ્રથમ, પ્રણવ વિદ્યાલયના

પર પણ સવાલ ઉઠ્યા છે સાથે સાથે શાળાઓ છે. નર્મદાના ડેડિયાપાડાનું યક્ષ નિલેશકુમાર પ્રજાપતિ ૯૯.૮૮

વાલીઓ પણ ચિંતિત બન્યા છે. ગ્રેડ ૪૦.૮૧%, રાજપીપળાનું ૫૭.૭૭%, પીઆર સાથે દ્વિતીય, પિન્ટુલાલા

મુજબ પરિણામ પર નજર કરીએ તો તિલકવાડાનું ૬૪.૯૪%, સાગબારાનું હાઈસ્કૂલની શ્રીયાબા યશપાલસિંહ

નર્મદા જિલ્લાનું ગત વર્ષે કરતાં ૭% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ विद्यास्थनी हेतिङ।

ધરાવતી ૫, ૩૦%

નર્મદા જિલ્લાનું ધોરણ ૧૦નુ ગત વર્ષ કરતાં ૭% ઓછું

૫૫.૪૯% કંગાળ પરિણામ, દર વર્ષે પરિણામમાં ઘટાડો

રાજપીપળા વાત્સલ્ય

રોશન પટેલ ૯૯.૯૧

પીઆર સાશે

જિલ્લામાં પ્રથમ ક્રમે

પરિણામ ધરાવતી ૭, ૪૦% પરિણામ વાડવાનું ૬૮.૮૮%, બોરિયાનું

ટુંકી મુદ્દતની જાહેર નિવિદા ૦૧/૨૦૨૩–૨૦૨૪

વિભાગ આહવા -૩૯૪૭૧૦, ફોન નં.૦૨૬૩૧-૨૨૦૩૮૫ આહવાની

કચેરી દ્વારા સક્ષમ અને તજગ્ન સંસ્થા પાસેથી નાયબ કાર્યપાલક ઈજનેર,

ડાંગ પંચાયત (મા×મ) પેટા વિભાગ-આહવા હસ્તકનાં મકાનના કામોમાં

ખુટતા /સુધારણા કરવાપાત્ર પુલોના કામના ડીપીઆર/એસ્ટીમેટ/ડીટીપી તૈયાર કરવા અંગેની કન્સલ્ટન્સીની કામગીરીના ભાવો મંગાવવામાં આવે

છે. અત્રેની કચેરી ખાતે તારીખઃર૯/૦૫/૨૦૨૩ થી તા:૦૫/૦૬/૨૦૨૩

સુધીમાં કચેરી કામકાજના દિવસો દરમ્યાન સમય ૧૧:૦૦ થી ૧૬:૦૦

કલાક દરમ્યાન ટેન્ડર કી રૂા. ૯૦૦/– જમા કરાવ્યેથી કોરા ટેન્ડરો ઈશ્યુ

કરવામાં આવશે.ભરાયેલ ટેન્ડર રજીસ્ટર પોસ્ટ એડી. થી અત્રેની કથેરી

ખાતે તારીખઃ ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ૧૫:૦૦ કલાક સુધીમાં

દ્વારા જી.એસ.ટી.(ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ) લાગુ થયેલ છે.આથી

ઈજારદારશ્રીઓએ જી.એસ.ટી. મુજબના દરો ધ્યાને લઈ ભાવો ભરવાના

રહેશે. બિલમાંથી ચુકવણા સમયે લાગુ પડતો જી.એસ.ટી.ચુકવવાના

સ્થાનેથી કાપવા પાત્ર હશે તો તે કાપવામાં આવશે.આ અંગે કાયદામાં

વખતો વખત જે મુજબ ફેરફારો થશે તે મુજબ ટેક્ષ કપાત કરવામાં

કચેરીનાં જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં રસ ધરાવતા

(ક્રમાંક : માહિલી/ડાંગ/દ્૧/૨૦૨૩) ડાંગ પંચાયત (મા×મ) પેટા વિભાગ

વધુમાં જણાવવાનું કે, તારીખ:૦૧/૦૭/૨૦૧૭ થી સરકારશ્રી

આ કામની નોટીસ અંગેની વધુ માહિતી માટે ઉપરોક્ત

ઈ.એમ.ડી. ની રકમ રૂા. ૧૫,૦૦૦/– સાથે મોકલવાના રહેશે.

આવશે.બીજી તમામ બાબતો યથાવત રહેશે.

ઈજારદારશ્રીઓએ સંપર્ક સાધવા વિનંતી છે.

નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, ડાંગ પંચાયત(મા×મ) પેટા

B 1 ગ્રેડમાં ૩૬૯, B 2 ગ્રેડમાં ૫૦.૮૨%, નીવાલ્દાનું ૮૪.૪૦%, ક્રમે, રાજપીપળા વાત્સલ્ય વિદ્યાલયની

ગોહીલ ૯૯.૬૬ પીઆર સાથે ત્રીજા

ગરુડે શ્વરનું

86.03%,

જુના મોઝદાનું

પૅર.૫૦%,

ઉમરવાનું

€0.09%,

ઉતાવડીનું

99.68%,

જાનકી પ્રણવકમાર પંચાલ ૯૯.૬૦

પીઆર સાથે ચોથા ક્રમે, શ્રી નવદર્ગા

હાઈસ્કુલનો આદિત્ય પરેશ ખરી

૯૯.૩૮ પીઆર સાથે પાંચમા ક્રમે,

વ**ીયાની માય શાનેન સ્કુલની મૈ**રી

ઉપેન્દ્રકુમાર કટારીયા ૯૯.૧૯

ીઆર સાથે છકા ક્રમે, શ્રી નવદુર્ગા

હાઈસ્કુલના ક્રિશ સચિન પટેલ

૯૯.૦૮ પીઆર સાથે સાતમો ક્રમ

CHANGE OF NAME

spouse of No. 14629059W, Rank Ex-

NK DVR (MT), Name ZALA

RAJENDRA SINH HANUBHA, Resi.

Village Modhwana, Tal.-Lakhtar, Dist.

Surendranagar, State Gujarat,

Pin- 363110. I have changed my

name from MEERABA to ZALÁ

MANHARBA RAJENDRASINH

For all Purposes

Affid.No. GJ4097069 6800174V Dated 08.04.2023

સાંપડ્યા પછી અનેક નવા આયામો જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંી''. આ છે. અદાણી ફાઉન્ડેશનએ વાંસકળા માટે ગુજરાતમાં આદિમ જુથમાં સમાવિષ્ટ એમના કાર્ય એન ઝુંબેશમાં ઉમેરાયા સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં જુથને અમદાવાદમાં અદાણે સમુહના જરૂરી એરી મશીનરીનો સહયોગ આપ્યો કોટવાલિયા સમાજના લોકો વાંસની છે. વજીરભાઈ કોટવાળિયાને ભારતના સહભાગી થતાં રહ્યા છે. એમ છતાં કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા ગ્રામ છે. તાજેતરમાં પંક્તિબેન શાહના હસ્તે કલાકૃતિ બનાવવામાં નિપુષ્રતા ધરાવે રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર એમને બજારનો સંપર્ક ન હતો.અદાષ્ટ્રી ભારતીમાં ઉત્પાદનોનું પ્રદર્શન અને વાંસ કાપવા, પોલિશ કરવાટૂલબોક્સ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મુલાકાત માટે આમંત્રણ આપવામાં ફાઉન્ડેશન, દહેજના રીએસઆર વેચાણની તક મળી હતી સાથે જ અદાણી આપવામાં આવ્યા હતા.વજીરભાઈ હાથાકુંીના એવા જ કારીગર વજીરભાઈ આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાલિયા 🗟 હેડ ઉષાબેન મિશ્રા જણાવે છે કે અમે સમુહના ચેરમેન ગૌતમભાઈ અદાણી કોટવાળિયા જૂનના પ્રથમ સપ્તાહમાં કોટવાલિયા સમાજની વાંસ કળાને જીવંત સમાજની સ્થિતિ વિશે વાત કરવાની વજીરભાઈને મળ્યા ત્યારે આ કળા અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં જશે. રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ તક મળશે. વજીરભાઈ કોટવાલિયાએ જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર શીમતી ડૉ.પ્રીતિબહેન અદાણીની વજીરભાઈ કોટવાળિયા સમાજના છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને મર્યાદિત સંસાધનો સાથે પોતાના હોવાની વાત કરી હતી એટલે કોટવાળિયા મુલાકાતનો અવસર પણ મળ્યો હતો. પ્રતિનિધિ તરીકે છેલ્લા ૨૫ વર્ષથી વાંસ

દાયકામાં પ્રથમ વખત વિદેશી

નવી દિલ્હી,તા.૨૫

દેશમાં ૨૦૨૨-૨૩માં કુલ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ૧૬.૩ ટકા ઘરીને ડોલર ૭૧ બિલિયન થઈ ગયું છે. એક દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે નાણા:ીય વર્ષમાં એફરીઆઈના પ્રવાહમાં ઘટાડો થયો છે. અગાઉ ૨૦૧૨-૧ ૩માં કુલ એફરીઆઈમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે ટકા ઘટીને ડોલર ૨૮ બિલિયન થવાની ધારણા છે.

નામ બદલ્યુ છે

હું, રુત્યા, સુજાનસિંહ જાડેજા ની દિકરી,

બિરેન્દ્રસિંહ યુડાસમા ની પત્ની,

વચ ૨७, રહેણાંકઃ બી/૫૮, દુર્ગા નગર,

જૂના પાદરા રોક, ટ્યુબ કંપની પાસે,

વકોદરા-૩૯૦૦૨૦., મેં મારું નામ

તમામ हેતુઓ માટે

Affid.No. IN-GJ69082530285241V Dated 23.05.2023

-સહી-

વહીવટદાર

નગરપાલિકા કાલોલ

જી.પંચમહાલ

જાહેર નિવિદા (ઇ-ટેન્ડર) (બીજો પ્રયત્ન)

કાલોલ નગરપાલિકા સને ૨૦૨૩-૨૪

ચીફ ઓફિસરશ્રી કાલોલ નગરપાલિકા ફોન નં- (૦૨૬૭૬) ૨૩૫૬૦૫

ધ્વારા કાલોલ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ૦૨

અતર્ગત ઘન કચરા(લેગસી વેસ્ટ) ના નિકાલ માટે અંદાજિત રકમ

રૂા. ૧,૯૫,૯૦,૬ ૩૦/- માટે માન્ય શ્રેણીમાં નોંધાયેલ ઇજારદારો પાસે

થી ઓનલાઇન ઇ-ટેન્ડરીંગ થી ટેન્ડરો મંગાવવામાં આવે છે, જે વેબસાઇટ

http://www.nprocure.com ઉપર તારીખ ૦૮/૦૬/૨૦૨૩

ના રોજ ૧૮.૦૦ કલાક સુધી ડાઉનલોડ તથા અપલોડ કરી શકાશે. ટેન્ડર

સમયગાળો તા. ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ ૧૬.૦૦ કલાક સુધી સીલબંધ

કવરમાં નગરપાલિકા કાલોલ જી.પંચમહાલ પિન-૩૮૯૩૩૦ના સરનામે

(માહિતી/ગોધરા/૧૮૦/૨૩)

વિગતો ઉપર જણાવેલ વેબસાઇટ ઉપર થી જોવા મળશે.

કરવાની સત્તા નીચે સહી કરનાર ને અબાધિત રહેશે.

ચીફ ઓફિસર

નગરપાલિકા કાલોલ

જી.પંચમહાલ

તે ૨૬ ટકા ઘટીને ડોલર ૩૪.૨૯ બિલિયન ઘટાડો જોવા મળ્યો છે. સેન્ટલ બેંકના જણાવ્યા અનુસાર, ૨૦૨૧-૨૨માં દેશમાં કુલ ડોલર ૮૧.૯૭ બિલિયન એફરીઆઈ આવ્યું છે. જે ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૧૦ટકા વધુ છે. તાજેતરના આરબીઆઇ બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, ૨૦૨૨-૨૩માં ચોખ્ખી એકરીઆઈ પણ વાર્ષિક ધોરણે ૨૭

પ્રત્યક્ષ રોકાણમાં ૧૬%ઘટાડો

Stock Exchange under Regulation 33 of SEBI (LODR) Regulation 2015, The Full Format of the Quarter & Year ended Financial Results are available on the website of BSE Ltd. at www.bseindia.com and on the Company's website at www.welterman.com

Place: Vadodara

FEDERAL BANK

લોન કલેક્શન એન્ડ રીકવરી ડીપાર્ટમેન્ટ / મુંબઈ ડીવીઝન

LCRD/ भुंअर्थ डीवीञन

છાણી જકાત નાકા, વડોદરા, ગુજરાત, પિન- ૩૯૦૦૦૨ / એ ૬૦ ૬૧ ચોગીકુટીર સોસી, મરિચમ પાર્ક નજીક, પીકો વાડો રોડ, जुक्शत ३६००६०.

3. શ્રી મોહમ્મદગ્રમખાન રહીકુલ કૌશરખાન પઠાણ, જે રહીકુલ કૌશરખાન પઠાણના પુત્ર, બી-૨ ૨૦૫, ક્લેક્સાગર કોમ્પ્લેક્સ

ફતેગંજ, વડોદરા, ગુજરાત, પિન-૩૯૦૦૦૨,

(હવે પછી કાયદો તરીકે ઉલ્લેખ પામશે) ના સેક્શન ૧૩(૨) હેઠળ મોકલેલ નોટિસ

ફી બાનાની રકમ તથા અન્ય માંગેલ દસ્તાવેજો ફિઝિકલ રજૂ કરવાનો બિ) ફેડરલ પ્રાથ્યસ લોન (AMTL) ના ખાતાને. ૧૮૧૦૬૬૦૦૦૦૦૧૦૮ સાથે રૂા. ૫,૦૦,૦૦૦/- (રૂપીયા પાંચ લાખ પુરા) ના તા. ૦૪-૦૫

તેમના માંથી મુખ્ય કરજદાર તરીકે અને પાંચમા અને બીજા જામીનદાર આપનાર / સહ બંધનકર્તા/ સહકરજદાર/ ગીરવેદાર તરીકે લાભ લીધો છે.

ા સી) ફેડરલ પ્રાથ્યસ લોન (AMTL) ના ખાતા નં. ૧૮૧૦૬૬૦૦૦૦૦૦૯૦ સાથે રૂા. ૫,૦૦,૦૦૦/- (રૂપીયા પાંચ લાખ પુરા) ના તા. ૦૪-૦૫ ૨૦૧૭ના રોજઅનૌપચારીક ક્ષેત્રને તેમના દેવાની પૂર્વ ચુકવણીના હેતુ માટે

ડી) ફેડરલ પ્રાથ્યસ લોન (AMTL) ના ખાતા નં. ૧૮૧૦૬૬૦૦૦૦૦૦૭૪ સાથે રૂા. ૪,૦૦,૦૦૦/- (રૂપીયા ચાર લાખ પુરા) ના તા. ૦૪-૦૫

અલવે ખાતે રજીસ્ટર્ડ ઓફિસ ધરાવનાર કંપની એક્ટ હેઠળ નોંધાયેલ છે (ત્યારબાદ બેંક તરીકે ઓળખવામાં આવે છે).

ગીરો સ્થાવર મિલ્કતોનું વર્ણન

જે તે મિલકતના તમામ ભાગ અને હિસ્સા સાથે ૯૦.૭૬ ચોરસ મીટરનો પ્લોટ વિસ્તાર, સામાન્ય પ્લોટ અને ૪૮.૩૮ ચોરસ મીટરના રસ્તાના પ્રમાણસર હિસ્સા સાથે, અને તેના પર બાંધકામ, રેવન્યુ સર્વે નં. 657, ટીપી નં. 55 (A), એફ.પી.નં. 68, સબ પ્લોટ નં. B/4 પર આવેલું છે. ગોરવા તાલુકો, વડોદરા જિલ્લો, ગુજરાત રાજ્ય,એસઅારઓ વડોદરા ખાતે ''નિસાર રેસીડેન્સી''. જેની ચર્તુસીમા : પૂર્વમાં સીમિત: ૧૨ મીટર ટીપી રોડ, પશ્ચિમઃ પ્લોટ નંબર B/૧ ૩, ઉત્તરઃ પ્લોટ નંબર B/૩ અને દક્ષિણઃ પ્લોટ નંબર B/૫ .

ઉપરોક્ત ગિરવે સિકયોરિટી મિલ્કતો હવે 'સિકયોર્ડ અસ્કયામતો' તરીકે ઉલ્લેખાશે તમે ઉપરના સિકયોર્ડ દેણાની પરત ચુકવણીમાં કસુરક કરીને માન્ય શરતોનો ભંગ કર્યો છે અને એકાઉન્ટ્સ (બી) ૦૨-૦૮-૨૦૨૨ ના રોજ નોન પરફોર્મીંગ એસેટ બન્યું છે. (સી) ૦૪-૧૨-૨૦૨૨ ના રોજ નોન પરફોર્મીંગ એસેટ બન્યું છે. (એ) આરબીઓઈની માર્ગદર્શિકા મુજબ ૦૨-૦૧-૨૦૨૩ ના રોડ નોન પરફોર્મીંગ એસેટ બન્યા છે. (ડી)૦૩-૦૧-૨૦૨૩ ના રોજ નોન પરફોર્મીંગ એસેટ બન્યું છે.

નીચે સહી કરનાર ધ ફેડરલ બેંક લિ.ના અધિકૃત અધિકારી તરીકે તમને જાણ કરે છે કે વ્યાજ સાથે વત્તા ખર્ચ તમારી પાસેથી સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે બાકી છે, બેંકની <mark>વકોદરા વાદોડીંચા રોડ શાખામાં</mark> તમારા લોન ખાતા હેઠળ નીચે જણાવ્યા મુજબ સંયુકત રીતે અર્ને અલગથી આપવાનું

(એ) તમારી AMTL ના ખાતા નં. ૧૮૧૦૬ ૬૦૦૦૦૦૦૮૨ની તા.૦૪-૦૧-૨૦૨૩ ના રોજ થી ની બાકી રકમ રૂા. ૨,૨૮,૨૪૦.૦૮- (રૂપીયા બે લાખ અઠયાવીસ હજાર બસો ચાલીસ અને આઠ પૈસા પુરા)

(બી) તમારી AMTL ના ખાતા નં. ૧૮૧૦૬૬૦૦૦૦૦૧૦૮ની તા.૦૪-૦૧-૨૦૨૩ ના રોજ થી ની બાકી રકમ રૂા. ૨,૩૪,૩૧૪.૯૦- (રૂપીયા બે લાખ ચોત્રીસ હજાર ત્રણસો ચૌદ અને નેવું પૈસા પુરા)

(સી) તમારી AMTL ના ખાતા નં. ૧૮૧૦૬ ૬૦૦૦૦૦૦૯૦ની તા.૦૪-૦૧-૨૦૨૩ ના રોજ થી ની બાકી રકમ રૂા. ૩,૬૫,૯૯૭.૪૦- (રૂપીયા ત્રણ લાખ પાસઠ હજાર નવસો સતાણું અને ચાલીસ પૈસા પુરા)

(ડી) તમારી AMTL ના ખાતા નં. ૧૮૧૦૬૬૦૦૦૦૦૦૭૪ની તા.૦૪-૦૧-૨૦૨૩ ના રોજ થી ની બાકી રકમ રૂા. ૨,૩૦,૯૪૨.૧૨- (રૂપીયા

બે લાખ ત્રીસ હજાર નવસો બેતાલીસ અને બાર પૈસા પુરા)

આથી બેંક સિક્યોર્ડ ક્રેડિટર તરીકે કાયદાની કલમ ૨ (zd) હેઠળ જણાવ્યા અનુસાર જણાવેલ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ જણાવ્યા અનુસાર એ) તમારી ફેડરલ પ્રથ્યાશા લોન સાથે તમારા નંબર ૧૮૧૦૬૬૦૦૦૦૦૮૨ માં માસિક વિરામની સાથે તા. ૦૪-૦૧-૨૦૨૩ થી ૪% ઓવરડયુ

વ્યાજ સહીત ૧૨.૮૦% ના વાર્ષિક દરે

બી) તમારી ફેડરલ પ્રથ્યાશા લોન સાથે તમારા નંબર ૧૮૧૦૬૬૦૦૦૦૦૧૦૮ માં માસિક વિરામની સાથે તા. ૦૪-૦૧-૨૦૨૩ થી ૪% ઓવરડયુ વ્યાજ સહીત ૧૨.૮૦% ના વાર્ષિક દરે

સી) તમારી ફેડરલ પ્રથ્યાશા લોન સાથે તમારા નંબર ૧૮૧૦૬ ૧૦૦૦૦૦૦૯૦ માં માસિક વિરામની સાથે તા. ૦૪-૦૧-૨૦૨ ૩ થી ૪% ઓવરડયુ

વ્યાજ સહીત ૧૨.૮૦% ના વાર્ષિક દરે

ડી) તમારી ફેડરલ પ્રથ્યાશા લોન સાથે તમારા નંબર ૧૮૧૦૬૬૦૦૦૦૦૭૪ માં માસિક વિરામની સાથે તા. ૦૪-૦૧-૨૦૨૩ થી ૪% ઓવરડયુ વ્યાજ સહીત ૧૨.૮૦% ના વાર્ષિક દરે

આથી તમાને આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર જણાવેલ ૨કમની સાથેસાથે ચુકવણીની તારીખ સુધી તેના પર ચડત વ્યાજ અને ખર્ચ/અન્ય ચાર્જ સહિત ચુકવી જવા જણાવે છે, જેમાં નિષ્ફળ જતા બેકને સિક્યોર્ડ ક્રેડિટર તરીકે કોઇ અન્ય નોટીસ આપ્યા વગર, તેના કોઇપણ અન્ય હકો અને

ઉપયોગ પ્રત્યે પુર્વગ્રહ વગર તમારી સામે એક્ટની કલમ ૧૩(૪) હેઠળ જણાવેલ પગલાંઓ લેવાની ફરજ પડશે. ૧. ઉપર વર્ણન કરેલ સિકયોર્ડ અસ્કયામતોના કબજો લેવા અને લેણી રકમ વસૂલ કરવા તે કથિત અસ્કયામતોને લીઝ, એસાઈન્મેન્ટ અથવા વેચાણ

દ્વારા તબદિલ કરવી. ૨. સિક્યોર્ડ અસ્કયામતોનો વહીવટ હાથમાં લેવો અને લેણી ૨કમ વસુલ કરવા તે કથિત અસ્કયામતોને લીઝ, એસાઈન્મેન્ટ અથવા વેચાણ દ્વારા

૩. બેંક કબજે લીધેલ અસ્કયામતોનો વહીવટ કરવા માટે કોઈ વ્યક્તિની નિમણુક કરવી. ૪. તમારી પાસેથી કોઈ પણ સિકયોર્ડ અસ્કયામત સંપાદિત કરી હોય અને જેની પાસેથી તમારે કોઈ પૈસા લેણા થતા હોય તે બેકને ચુકવવા માટે તેવી

કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે લેખિત નોટીસ જરૂર પડયે આપવી. તમને કાયદાના સેકશન ૧૩(૧૩) તરફ ધ્યાન દોરવામાં આવે છે કે તમે આ નોટીસ મળ્યા પછી, વેચાણ, લીઝ કે અન્ય કોઈ રીતે નોટીસમાં ઉલ્લેખ

કરેલ કોઈ પણ સિકયોર્ડ અસ્કયામતોને બેંકના હિત માટે ગમે તે પૂર્વગ્રહ હોય પણ બેંકની લેખિત પૂર્વમંજૂરી સિવાય તબદિલ કરી શકશો નહીં. તમને કાયદાના સેકશન ૧૩(૬) તરફ ધ્યાન દોરવામાં આવે છે જે દ્વારા બેંકની સિકયોર્ડ અસ્કયામતની તબદિલી જે આવી સિકયોર્ડ અસ્કયામચાન માલિક દ્વારા જે રીતે જે કે વ્યક્તિ(ટ્રાન્સફરી)ને કરવામાં આવી હોય તે વ્યક્તિને તબદિલી માટે માન્ય ટાઈટલના તમામ અધિકારો આપવાનો, અથવા એનાં સંદર્ભમાં આપવા માટે તે રીતના અધિકાર આપે છે. મહેરબાની કરીને જાણી લેજો કે તમારી જવાબદારી આ નોટીસની તારીખ થી દિન ૬૦ માં પુરેપુરી અદા કરવામાં કસુર કરવાની સ્થિતીમાં અને બેંક કાયદાની જોગવાઈઓ હેઠળ પગલાં લેવા શરૂ કરે તે સમયમાં તમે બેંકને તમામ કોસ્ટ, ચાર્જસ અને આ સંદર્ભમાં થનાર તમામ ખર્ચ આપવમાં બંધાયેસા છો. તમને કાયદાના સેકશન ૧૩(૮) ની જોગવાઈ તરફ પણ ધ્યાન દોરવામાં આવે છે જેમાં સિકયોર્ડ અસ્કયામતો (સિકયોરિટી મિલ્કતો) છોડાવવાની સમય મર્યાદા જણાવેલ છે. જો સિકયોર્ડ અસ્કયામતોના વેચાણથી પણ લેણું પુરે પુરું વસુલ નહીં થાય, તો બેંક બાકીની રકમની વસુલાત માટે વ્યક્તિગત રીતે તમારી સામે કાર્યવાહી કરશે. આ નોટિસ બેંકને એના લેણાની વસુલી કરવા માટેમળેલ અન્ય અધિકારો એને ઉકેલના પૂર્વગ્રહ વિના મોકલેલ છે.

વતી, ધી ફેડરલ બેંક લી. (સરફૈસી એકટ, ૨૦૦૨ હેઠળ અધિકૃત અધિકારી)

જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૧૦૨, એ-૨ ગ્રેડમાં શૈક્ષણિક કારકિર્દીની પ્રથમ સીી ધોરણ ૧૦ને માનવામાં આવે છે. પોતાનું બાળક

ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપવાનું હોવાનું બાળકના વ**ીલો આગોતરું આયોજન ક**ી સારામાં સારુ ટ્યુશન, માર્ગદર્શન સહિત બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા સાથે આખું વર્ષ લગ્ન પ્રસંગશી લઈ તહેવારોમાં જવાનું તળતા હોય છે. બાળક અને પરિજનોની આખા વર્ષની મહેનતનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. ગુજરાત બોર્ડ થકી માર્ચ માસમાં વિધાર્શીનો ઘટાડો નોંધાયો હતો અને ગતવર્ષની લેવાયેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાંથી ૧૮,૩૬૮ પૈકી ૧૮,૨૬૧ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૧,૧૫૨ - ૨,૯૭૨ વિધાર્થીઓ બે વિષયમાં નાપાસ થતા વિધાર્શીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા જેમાં જૂનમાં પુરક પરીક્ષા આપવી પડશે.

૮૯૧, બી-૧ માં ૧૮૦૭, બી-૨ માં ૨,૯૭૮ અને સી-૧માં ૩,૫૩૫ વિધાર્થી ઉત્તીર્ણ થયા હતા. ભરૂચની ૧૩ શાળાઓનું ૧૦૦% જ્યારે ૩ શાળાનું ૦% પરિણામ જાહેર થયું છે. સૌથી વધુ ભરૂચ ૩ કેન્દ્રનું ૭૮.૨૯%, સૌથી ઓછું દરિયા કેન્દ્રનું ૩૮.૫૭% જ્યારે અંકલેશ્વર જીઆઇીસીનું ૭૬.૦૮% અંકલેશ્વરનું ૭૨.૨૦% અને ભરૂચનું ૬૧ ટકા પરિણામ રહ્યું છે. ગત વર્ષ કરતા એ-૧ માં ૧૧૨ તુલનામાં ૩.૫૯% નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ૪,૧૩૭ છાત્રો એક વિષયમાં અને



WELTERMAN INTERNATIONAL LIMITED

CIN: L51100GJ1992PLC017613

Regd. Office & Factory: Plot No. 1135, At & Post: Lamdapura, Lamdapura Road,

Tal. Savli, District Vadodara - 391 775. Ph.: (0265) 2310250/ 251
E-mail: Welterman baroda52@gmail com Website: www.welterman.com **Extract of Statement of Standalone Audited Financial Results**

act of statement of standart	JIIG MUUILGU I	IIIaliciai nes	uita
for the Quarter & Year	r ended 31.03	3.2023	
	(₹	t in Lakhs except	per share data)
culars	Quarter	Year	Corresponding

Sr. No.	Particulars	Quarter Ended	Year Ended	Corresponding Quarter ended
		31.03.2023	31.03.2023	31.03.2022
1	Total Income from Operations	8.75	84.45	201.34
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	6.34	-29.98	125.00
3	Net Profit/(Loss)for the period before tax (after Exceptional and/or Extraordinary items)	6.34	-29.98	125.00
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	6.34	-29.98	125.00
5	Total Comprehensive Income for the period	6.34	-29.98	125.00
6	Equity Share Capital	444.13	444.13	444.13
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-1,653.18	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic & Diluted	0.14	-0.67	2.81
Note	: The above is an extract of the detailed format of	Quarter & Year Er	ded Finacial Resu	ults Filed with the

Date: 25.05.2023

Huma Madani Director DIN: 07964833

દા કેડરલ બેંક લી.

એડ્રેસઃ ૧૩૪, ૧૩મો માળ, જોલી મેક્સ ચેમ્બર્સ નં.૨, નરિમાન પોઈન્ટ, મુંબઈ ૪૦૦૦૨૧

રુત્વા સુજાનસિંહ જાડેજા થી બદલીને ૧. શ્રીમતી ખાન તહનસીનબાનો મોહમ્મદકરમ જે પઠાણ મોહમ્મદ અકરમ રહીકુલ કૌસરના પત્ની. ૨૦૫, ઉનડદીપ સેન્ટર, **રુત્યાબા બિરેન્દ્રસિંહ યુકાસમા** રાખ્યું છે

ર. શ્રી પઠાણ મોહમ્મદ અક્રમ રહીકૂલ કૌસર જે રહીકૂલ કૌશરખાન પઠાણના પુત્ર, ૨૦૫, ઉનાદીપ કેન્દ્ર, છાણી જકાત નાકા, વડોદરા ગુજરાત, પિન -3૯૦૦૦૨

૪. શ્રી નઈમંત્રુરઆલમ ખાન, મંત્રુર આલમ ખાનના પુત્ર, ૨૦૫, ઉનાકદીપ સેન્ટર, છાણી જકાત નાકા, વડોદરા, ગુજરાત, પિન -૩૯૦૦૦૨

૫. શ્રી એન એ ખાન, જે અમન ગની ખાનના પુત્ર, એ-૯૨, રહેમત પાર્ક સોસાયટી, ગોરવા, વડોદરા, ગુજરાત, પિન- ૩૯૦૦૧૬,

🦫 શ્રીમતી ખાન ફઝૌલત ખાઝીના,જે મોહમદઝામખાન રહીકૂલ કોશરખાન પઠાણના પત્ની, બી-૨ ૨૦૫, ફતેહસાગર કોમ્પ્લેક્સ, ફતેગંજ

. सिड्योरिशर्छाजेशन એन्ड रीडन्स्ट्र्डशन ओइ झर्छनान्शियल એसेट्स એन्ड એनझेसीम्ट ओई सिझ्योरीटी छन्टरेस्ट, डायहो, २००

. તેમના માંથી ૧લા એ મુખ્ય કરજદાર તરીકે અને બીજાએ જામીનદાર/સહ-બંધનકર્તા/સહ-કરજદાર/ગીરવેદાર તરીકે લાભ લીધો છેઃ એ) ફ્રેડરલ પ્રાથ્યસ લોન (AMTL) ના ખાતા નં. ૧૮૧૦૬૬૦૦૦૦૦૦૮૨ સાથે રૂા. ૫,૦૦,૦૦૦/- (રૂપીયા પાંચ લાખ પુરા) ના તા. ૦૪-૦૫ ૨૦૧૭ ના રોજ અનૌપચારીક ક્ષેત્રને તેમના દેવાની પૂર્વ ચુકવણીના હેતુ માટે તેમના માંથી મુખ્ય કરજદાર તરીકે અને ચોથા અને બીજાે જામીનદાર ઑપનાર / સહ બંધનકર્તા/ સહકરજદાર/ગીરવેદાર તરીકે લાભ લીધો છે.

૨૦૧૭ ના રોજ અનોપચારીક ક્ષેત્રને તેમના દેવાની પૂર્વ ચુકવણીના હેતુ માટે

રજી.પોસ્ટ.એડી/સ્પીડપોસ્ટ થી મોકલવાનો રહેશે આ ટેન્ડર સબંધી વધુ તેમના માંથી મુખ્ય કરજદાર તરીકે અને ત્રીજા અને બીજા એને છહા જામીનદાર આપનાર / સહ બંધનકર્તા/ સહકરજદાર/ ગીરવેદાર તરીકે લાભ લીધો કોઈ પણ એક ટેન્ડર મંજુર કરવા અથવા તમામ ટેન્ડરો નામંજુર (રદ)

૨૦૧૭ ના રોજ અનૌપચારીક ક્ષેત્રને તેમના દેવાની પૂર્વ ચુકવણીના હેતુ માટે ફ્રેડરલ બેંક લીમીટેડ તરફથી, બેંકની તરફેણમાં જરૂરી સુરક્ષા કરાર/લોન દસ્તાવેજો અમલમાં મૂક્યા પછી તેની વડોદરા વાઘોડીયા રોડ શાખા દ્વારા

બેંક પાસેથી મેળવેલ ઉપરોક્ત ધિરાણ સુવિધાઓની સુરક્ષા માટે, તમારામાંથી બીજા નીચેની સ્થાવર મિલકતોના ગીરો દ્વારા બેંકના ફેવરમાં સીક્યુરીટી ઈન્ટરેસ્ટ લેવામાં આવશે.

HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020.

Extract of statement of standalone and consolidated financial results for the quarter and year ended March 31, 2023

		(₹ in lacs except per share data)										
S.	P		S	tandalone			Consolidated					
No.		Quarter ended			Year	ended		Quarter ended		Year ended		
	Particulars	March 31, 2023	December 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022	March 31, 2023	December 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31 2022	
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	
1	Total Income from Operations	15,070.02	10,637.03	4,432.18	40,895.67	14,730.88	17,932.03	17,156.25	4,362.66	56,771.08	16,718.9	
2	Net Profit for the period (before tax and exceptional items)	10,697.14	1,591.98	2,347.15	16,366.73	7,019.04	11,011.82	4,815.05	764.93	20,951.17	5,405.0	
3	Net Profit/(loss) for the period before tax (after exceptional items)	10,697.14	1,591.98	(1,089.38)	16,366.73	3,582.51	11,011.82	3,593.06	(2,671.60)	19,729.18	1,968.4	
4	Net Profit/(loss) for the period after tax (after Exceptional items)	10,697.14	1,591.98	(1,089.38)	16,366.73	3,582.51	10,665.39	3,733.58	(2,721.14)	19,404.82	1,999.3	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10,703.35	1,590.97	(1,096.61)	16,369.90	3,578.45	10,671.60	3,732.57	(2,728.37)	19,407.99	1,995.3	
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	
7	Reserves				79,740.47	63,370.57				81,494.32	62,086.3	
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized) Basic EPS ₹ Diluted EPS ₹	₹ 8.09 ₹ 8.09	₹1.20 ₹1.20	₹ (0.82) ₹ (0.82)	₹ 12.37 ₹ 12.37	₹ 2.71 ₹ 2.71	₹ 8.06 ₹ 8.06	₹ 2.82 ₹ 2.82	₹(2.06) ₹(2.06)	₹14.67 ₹14.67	₹ 1.5° ₹ 1.5°	

The above is an extract of detailed format of Quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results is available on the stock exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com

> BY ORDER OF THE BOARD For Hindustan Oil Exploration Company Limited P. Elango R. Jeevanandam Managing Director Director & CFO



DIN: 07046442



DIN: 06475821

તારીખ ૧૨મી જાન્યુઆરી ૨૦૨૩ ના દિવસે છે.

